

S. E. POWER LIMITED

CIN : L40106GJ2010PLC091880

Date: 11th May, 2023

The Manager
Department of Corporate Relationship
BSE Limited
25 P. J. Towers, Dalal Street
Mumbai-400001

The Asstt. Vice President
National Stock Exchange of India Limited
Exchange Plaza, Bandra Kurla Complex
Bandra (East)
Mumbai-400051

Ref.: Scrip Code: 534598

Scrip Symbol: SEPOWER

Sub.: Intimation regarding Publication of Financial Results in Newspapers

Dear Sir/Madam

Please find attached herewith the copy of Newspapers in which the financial results of the Company for the quarter and Year ended March 31, 2023, as approved by the Board of Directors of the company in their meeting held on May 08, 2023, were published on May 09 2023, pursuant to applicable regulations of SEBI(LODR) Regulations, 2015.

Kindly keep the same in your record.

Thanking You,

Yours Faithfully,

For S. E. Power Limited

(Saurabh Agrawal)
Company Secretary

Encl.: As above

Registered Office & Works

54/B, Pratapnagar, Jarod - Savli Road, Samlaya, Vadodara - 391520, Gujarat, India.
Phone +91 2667 251566 | Mobile : 82380 27440 | E-mail : info@sepower.in | website : www.sepower.in

Tender Notice for "Duty Free Facilities & Services"

GMR Goa International Airport Limited (GGIAL) invites bids for Designing, Developing, Operating and Managing Duty free facilities & Services at Manohar International Airport, Goa complying with the Concession Agreement signed between GGIAL & Government of Goa.

Ref. No.: GGIAL/Duty Free/2023-24
Email: nonaerobd.ggial@gmrgroup.in

Further details can be accessed at <https://www.gmrgroup.in/goa> from 09.05.2023

MANOHAR INTERNATIONAL AIRPORT, GOA

ADITYA BIRLA HOUSING FINANCE LIMITED

Registered Office- Indian Rayon Compound, Veraval, Gujarat- 362266 Branch Address:- 2nd Floor, Yogi Complex, 150 Feet Ring Road Near Indira Circle, Vasundhara Omkar Society Manharpura 1, Madhapur, Rajkot Gujarat-360005

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas the undersigned being the authorized officer of Aditya Birla Housing Finance Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand notice dated 12.05.2021 calling upon the borrowers Natubhai Nariagar & Dharmesh Natubhai Nariagar to repay the amount mentioned in the notice being Rs. 23,78,711/- (Rupees Twenty Three Lacs Seventy Eight Thousand Seven Hundred Eleven Only) within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of the powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 07th Day of May of the year 2023. The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Aditya Birla Housing Finance Limited for an amount of Rs. 23,78,711/- (Rupees Twenty Three Lacs Seventy Eight Thousand Seven Hundred Eleven Only) and interest thereon. Borrowers attention is invited to the provisions of sub-section 8 of Section 13 of the act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property
All That Part And Parcel Of The Property Consisting Of Plot No 30 - , Block No 3 Nr Ajidem Chokdi ,Shivam Park, Bhavnagar Road, Rajkot Aji Ind Estate S.O, Rajkot, Gujarat, India - 360003.

Authorised Officer
Place: Rajkot Aditya Birla Housing Finance Limited

pnb पंजाब नैशनल बैंक Punjab National Bank

Circle SASTRA, 6th Floor, Gujarat Bhavan, Nr. M. J. Library, Ellisbridge, Ahmedabad - 380 006.

Appendix-IV [Under Rule 8(1)] POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorised Officer of Punjab National Bank, under the Securitisation and Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules-2002, issued Demand Notice dated 18.01.2023 calling upon the Borrowers Kaushik Amrutlal Zala (Borrower) and Amrutlal Vallabhdas Zala (Guarantor & Mortgagor) to repay the amount mentioned in the notice being Rs. 16,34,762.78 (Rupees Sixteen Lakhs Thirty Four Thousand Seven Hundred Sixty Two and Paise Seventy Eight Only), within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 06.05.2023.

The Owner of the Property in particular, and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Punjab National Bank, for an amount of Rs. 16,34,762.78 (Rupees Sixteen Lakhs Thirty Four Thousand Seven Hundred Sixty Two and Paise Seventy Eight Only) as on 16.01.2023 and interest thereon, costs etc.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
All that part and parcel of the Immovable Property situated at Raw House No. D-106, Plot Area 35 Sq. Yards. (as per AMC tax bill admeasuring about 36.75 Sq. Mtrs.) In the scheme known as "Parasprabhu Co. Op. Hou. Soc. Ltd.", Survey No. 332, 335 & 337, Mouje: Isanpur, Dist: Ahmedabad-5 (Narou), Gujarat. Bounded by: East: Raw House No. D-105, West: Raw House No. D-107, North: 10 Ft. Margin, South: Road.

Date: 06.05.2023 | Place: Ahmedabad | Sd/- Authorised Officer, Punjab National Bank

S. E. POWER LIMITED
CIN : L40106GJ2010PLC091880

Regd. Off: Survey No. 54/B, Pratapnagar, Jarod-Savli Road, Samlaya, Vadodara-391520 (Guj.)
Tel.: +91 2667 251566, E-mail: cs@sepower.in, Website: www.sepower.in

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS (CONSOLIDATED) FOR THE QUARTER & YEAR ENDED 31ST MARCH, 2023

(₹ in Lacs except EPS)

Particulars	Three Months Ended			Year Ended	
	31.03.2023 (Audited)	31.12.2022 (Unaudited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)
Revenue from operations	1620.40	1360.33	1248.50	5774.17	4803.85
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(87.31)	(4.02)	(98.38)	(224.39)	(409.21)
Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	(87.31)	(4.02)	(85.25)	(224.39)	(396.08)
Net Profit for the period after tax	(65.45)	(3.24)	(64.46)	(168.52)	(296.78)
Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(65.45)	(3.24)	(64.46)	(168.52)	(296.78)
Paid up Equity Share Capital (Face value of Rs. 10/- per share)	4061.00	4061.00	4061.00	4061.00	4061.00
Reserves excluding Revaluation Reserves (as per balance sheet of previous accounting Year)	—	—	—	(3458.37)	(3289.85)
Earnings per Share (of Rs. 10 each) (not annualised) Basic & Diluted:	(0.16)	(0.01)	(0.16)	(0.41)	(0.73)

Public Notice

This is to inform that to the General Public at large that My Clients (1) Patel Jayeshbhai Becharbhai and (2) Patel Pareshbhai Becharbhai, Both R/O At- Manasa, Tal- Manasa, Dist- Gandhinagar, Gujarat are Present Jointly Owner's of the Property "All that piece & parcel of land along with structure standing there on and to be constructed there on being immovable property Non Agriculture land Residential & Commercial Purpose Property out of Revenue Survey No.1794/1, Account No.5213, total admeasuring 26000.00 Sq.Meter situated in the sim of Village- Manasa, Tal- Manasa, Dist- Gandhinagar, State- Gujarat". There after said property has been converted in Non Agriculture land for Multi Purpose use by order of Honorable Collector, Gandhinagar bearing its order No.292/06/02/234/2023 dated 23/01/2023 and also Lay out plan for residential & Commercial purpose approved by competent authority. That as per lay out plan development agreement executed between (1) Patel Jayeshbhai Becharbhai and (2) Patel Pareshbhai Becharbhai and Gurujii Gokuldam Premlium Pathi firm having its Administrative Partner Mr.Dipakumar Lalitbhai Rathi duly registered with sub registrar office Manasa with serial Index No.2374 dated 11/04/2023.

The said property free from any charges, encumbrances, lien, Attachment, Government dues and free from reasonable doubt, The said property running on the name of My Clients in revenue record and also in jointly possession of My Clients.

Any person whoever has found having any right, title, claim, share of into/up to the said property by way sale, exchange, mortgage, let, maintains, easement, trust, possession or otherwise of what so ever nature hereby required to make the same in writing along with the documentary evidence to the undersigned at the address mentioned below within 14 days from the date of publication, failing which it shall be deemed to have been waived and given up and our client shall proceed further without reference to such claims, if any received afterwards and also I have been issued title search report. This notice issued by me and herewith mention Address for invite objections.

Place:- Palanpur Ramesh K.Tharwani Advocate & Notary
Date:-08/05/2023
16,Trimurti Complex, 2nd Floor, Nr.SBI Bank, Abu High Way, Palanpur, Pin-385001.
Tal:- Palanpur, Dist:- B.K. Mobile No:- 9925099400

HDFC HOUSING DEVELOPMENT FINANCE CORPORATION LTD. 201-204 Riddhi Shoppers, Opp. Imperial Square, Adajan Hazira Road, Adajan, Surat-395 009 Ph.No.0261-4141212

POSSESSION NOTICE

Whereas the Authorized Officer/s of Housing Development Finance Corporation Limited, under Secularization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice/s, incidental expenses, costs, charges etc till the date of payment and / or realization.

Sr. No.	Name of Borrower (s) / Legal Heir(s) and Legal Representative(s)	Outstanding Dues Rs. as on Dt	Date of Demand Notice	Date of Possession/ Physical /Symbolic	Description of Immovable Property (ies) / Secured Asset (s)
1.	Mr Gheewala Rajan Nareshbhai (Borrower), Mr Gheewala Nareshchandra Mohanlal (Co-Borrower) 144161- 643608271	Rs.30,27,140/- as on 30-NOV-2022	13 -DEC -2022	Physical 04-MAY-2023	Flat- C-1003, Floor-10, Orchid Harmony - B & C - Wing, S. No. 99, 100/2, 101, Block 210/B, FP-114- Sub Plot-B/P/National, Plot No. A & B, Opp. Fire Station Gaurav Path, Palanpur, Surat - 395009.
2.	Mr Sarang Niravkumar Vinaybhai (Borrower), Mrs Sarang Dipavilben Vinaybhai (Co-Borrower) 150883-637814741,637814772, 658061720, 638540128, 656510758, 638539924	Rs.5,95,914/- Rs.3,92,242/- Rs.17,976/- Rs.6,055/- Rs.4,75,562/- Rs.8,916/- AS ON 31-DEC-2022	08 -FEB -2023	Physical 05-MAY-2023	Floor- 1st, Unit- Shop-128, Shiven Squares No. 396/1, Block 364, FV 87, TP 14, Opp Swastik Party Plot, Nr. Simandhar Heights, Nr Kushal Vatika, Pal, Surat-395005.

*with further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realization. However, since the borrowers / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above have failed to repay the amounts due, notice is hereby given to the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above in particular and to the public in general that the Authorized Officer/s of HDFC have taken Physical possession of the immovable property (ies) / secured asset(s) described herein above in exercise of powers conferred on him/hem under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above.

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Immovable Property(ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of Housing Development Finance Corporation Ltd.

Date: 09/05/2023 For Housing Development Finance Corporation Limited. Authorised Officer. Place: SURAT
Regd. Office: Ramon House, H T Parekh Marg, 169, Backbay Reclamation, Churahgate, Mumbai- 400020. Corporate Identity Number: L70100MH1977PLC0119916

Union Bank of India Gandhinagar Regional Office, 2nd Floor, Near Navrangpura Post Office, Opp. Navrangpura Bus Stop, Navrangpura, Ahmedabad - 380009

NIT FOR INTERIOR WORK OF UNION BANK OF INDIA, KALOL BRANCH & ATM PREMISES

Union Bank of India, Regional Office Gandhinagar, invites sealed tenders in two-bid system i.e. Technical Bid and Commercial/Price Bid from eligible established contractors having registered office in Ahmedabad or Gandhinagar for carrying out Interior work at Union Bank of India, Kalol Branch & ATM Premises (Site Location: Shop No. 1 & 2, Ground Floor, Riyansh Complex, Near City Mall, Kalol). Eligible firms / contractors may obtain the tender forms from the above-mentioned address during working hours from 09.05.2023 to 30.05.2023 till 3.00 PM.

The tender document along with detailed terms and conditions are also available during aforesaid period on Bank's website www.unionbankofindia.co.in and www.eprocure.gov.in. The estimated cost of work is Rs. 14,97,695/- + GST as applicable and the Completion period is 45 days. Interested bidders may submit applications in two bid format (Technical bid and Commercial bid) along with non-refundable Tender Fees of Rs. 1,000/- on or before 30.05.2023 by 3 PM at above mentioned address situated at Ahmedabad. Technical bids of all received bids will be opened in presence of all bidders / representatives at 3:30 PM on 30.05.2023. For more details, please refer tender document.

Applicants registered as MSME / NSIC / Udyog Aadhar / SSI Scheme are exempted from depositing tender fee / EMD provided they attach self-attested copy of the relevant certificate. Union Bank of India reserves the right to reject any or all applications received without assigning any reasons whatsoever.

Regional Head

ABHYUDAYA CO-OP. BANK LTD. (Multi-State Scheduled Bank)

Development Dept. 1st Floor, Abhyudaya Bank Building, Sector -17, Vashi, Navi Mumbai- 400 703
Tel. No. 022-27890648, 649 • Website : www.abhyudayabank.co.in

NOTICE FOR SALE OF BANK PREMISES

Abhyudaya Co-op. Bank Ltd. intends to sell its owned property, more specifically mentioned hereunder along with the corresponding rights arising out of the ownership thereof, as detailed hereunder on "As is where is, As is what is, Whatever there is basis and without Recourse". The auction sale will be 'Online E-Auction' Bidding through the website <https://eauction.auctiontiger.net> (Rs. In Lakh)

Sr. No.	Description & Location of Property	Reserve Price	Earnest Money Deposit (10 % of R.P.)
1.	Shop No. 2222/1 and 2222/1/1, City Survey No. 3564, 3565 paiki, 1st Floor, Mahurat Pole, admeasuring about 340 sq. ft. (Built up area), Opp. Old Share Bazar, Manekchowk, Ahmedabad-380 001	Rs. 34.50	Rs. 3.45

- The intending purchasers/bidders are required to pay the Earnest Money Deposit (EMD) amount to be transferred by RTGS to Account No. 001065100000001, IFSC code ABHY0065001 in favour of "Abhyudaya Co-operative Bank Ltd." on or before 22.05.2023 upto 5.00 p.m.
- Premises will be kept open for inspection on 16.05.2023 and 17.05.2023 between 10:00 a.m. to 5:00 p.m.
- Title Documents of the property will be available for inspection at Regional Office, Jayamangal House, Ellisbridge, Ahmedabad on any working day from 09.05.2023 to 22.05.2023 btwn. 10.00 a.m. to 5.00 p.m.
- The Bank reserves its rights to accept/reject any offer and/or to modify and/or to cancel and/or to postpone the Auction/Bid.
- Online Auction will be conducted on 24.05.2023 between 3.00 p.m. to 4.00 p.m.
- The interested bidders are required to register themselves with the portal and obtain login ID and Password well in advance, which is mandatory for e-bidding, from auction service provider M/s. E-Procurement Technologies Ltd./Auction Tiger, B-704, Wall Street - II, Opp. Orient Club, Nr. Gujarat College, Ellis Bridge, Ahmedabad - 380006 Gujarat (India). Contact Nos.: Mr. Praveenkumar Thevar - 9722778828-079-35022145/149/182, praveen.thevar@auctiontiger.net and Contact person of Bank Mr. Vikas Sharma 8160827088.
- Detailed terms and conditions of the sale are set out in the Tender Forms which are available on Bank's website www.abhyudayabank.co.in as well as on <https://eauction.auctiontiger.net>

Place : Navi Mumbai Authorised Officer Dy. Gen. Manager - Development Dept. Date : 09/05/2023

Indian Bank Nana Varachha Branch, Shop No. 5-6-7, Sarthi Complex, Hirabag Circle, Varachha Road, Surat.

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, The undersigned being the authorized officer of the Allahabad Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 17-05-2022 calling upon the borrower/ Guarantor Mr. Hitesh Mansukhbhai Nakrani (Borrower & Mortgagor) to repay the amount mentioned in the notice being Rs.21,03,884/- (Rupees Twenty One Lakh Three Thousand Eight Hundred Eighty Four only) along with interest and other charges within 60 days from the date of receipt of the said notice.

The borrower/guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 07th day of May 2023.

The borrower/mortgagor/guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Indian Bank, for an amount of Rs.21,03,884/- along with interest and other charges thereon.

The borrower's attention is invited to the provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
All that piece and parcels of the immovable property bearing Plot No. 62 (as per Passing Plan Plot No. A/62), adm. 84.44 sq. yard. i.e. 70.76 sqmtrs. (As per passing plan 70.76 sq.mtrs.) together with undivided share in road & C.O.P. in "Shakti Lake City Vibhag -A", Situated on the land bearing R. S. No. 99, Block No. 95, adm. 32583 sq.mtrs. (New Survey No. 2426, adm. 71 sq.mtrs.) of Village : Nansad, Taluka: Kamrej, District Surat. Standing in the name of Hitesh Mansukhbhai Nakrani. Boundaries: North: Plot No. 61, South: Plot No. 63, East: Plot No. 82, West: Society's Internal Road.

Date: 07/05/2023 Authorised Officer, Place: Surat Indian Bank, Nana Varachha Branch, Surat.

SBI STATE BANK OF INDIA Stressed Assets Recovery Branch (SARB) : 7th Floor, Paradise Complex, Savayiganj, Vadodara - 390005, Phone : 0265-2225291/92, Email : sbi.10059@sbi.co.in

PUBLICATION OF NOTICE REGARDING POSSESSION OF PROPERTY U/S 13(4) OF SARFAESI ACT 2002

Whereas, the undersigned being the Authorised Officer of State Bank of India, Stressed Assets Recovery Branch, 7th Floor, Paradise Complex, Savayiganj, Vadodara - 390005 under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated mentioned against each account and stated hereinafter calling upon the Borrower / Co-Borrower / Guarantor to repay the amount mentioned in the notice being below mentioned with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs charges within 60 days from the date of receipt of the said notice. The Borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, legal heirs (known - unknown), legal representatives (known - unknown), guarantor and the public in general that the undersigned, as per Order & Dated as mentioned below, has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said [Act] read with Rule 8 of the said rules on this 7th day of Month May of the year 2023. The Borrower, legal heirs (known - unknown), legal representatives (known - unknown), guarantor and the public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of State Bank of India for an amount below mentioned with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs charges thereon. The borrower's attention is invited to provision of Sub-Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Sr. No.	Name of Account/ Borrower	Demand Notice & Amount Outstanding in Rs.	Description of the property mortgaged/ charged	Order No. Order Date
1.	Shri Bharatbhai Kantilal Patel (Borrower), Smt. Urmilaben Bharatbhai Patel (Co-Borrower) & Shri Bhikhabhai Chhanabhai Dhoyva (Guarantor)	01.11.2021 Rs. 28,37,039.92 as on 31.10.2021	All that part and parcel of immovable property situated at Plot No. 72, adm. 60.22 sq. Mtrs. with proportionate undivided inchoate share of road and C.O.P. adm. 23.52 sq. mtrs. land in "Maa Anandi Township" with all appurtenances pertaining thereto, standing on land bearing R.S. No. 8/3/B & 8/3/A, Block No. 14 and Block No. 15 respectively, lying, being and situated at, Vill. Deladva, Sub Dist. Choryasi, Dist. Surat. Bounded by : East : Adj. Block No. 31, West : 18 Feet Society Internal Road, North : Adj. C.O.P., South : Plot No. 71.	compliance of Order of 4 th Additional Chief Judicial Magistrate, Surat dated 06.04.2023 in CRMA.J No. 609 of 2023
2.	Mr. Mahendrabhai Vanmalibhai Prajapati and Mr. Ritesh Mahendrabhai Prajapati	06.09.2022 Rs. 90,94,519.49 as on 06.09.2022	All that piece and Parcel of Flat No. 902, 9th Floor, Shanti Niketan, Near Vesu Char Rasta, Udhana-Magdalla Road, Vesu, Surat.Old R.S. No. 594, New R.S.No.389, TP No.28, FP No.39, Mouje, Vesu, Sub Dist. Taluka Surat City Dist. Surat, Area : Super Built Up: 190.54, Sq.Mtr. Built Up : 127.85 Sq. Mtr. in the Name of Mahendrabhai Vanmalibhai Prajapati. Bounded by :- East : Society Road, West : Block No. 209, North : Villa No. 118, South : Villa No. 120.	compliance of Order of 5 th Additional Chief Judicial Magistrate, Surat dated 02.01.2023 in CRMA No. 3801 of 2022

Date : 07.05.2023 Authorised Officer, Place : Surat State Bank of India, SARB, Vadodara

Indian Bank NANA VARACHHA BRANCH, G-5, 6 & 7, Sarthi Complex, Hira Bag, Varachha Road, Surat. Ph. : 0261-2559099 Email : nanavarachha.surat@indianbank.co.in

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, The undersigned being the authorized officer of Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred to him under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 09/08/2020 calling upon the borrower/guarantor M/s. Raj Sales Agency (Proprietorship Firm), Mr. Prakashchandra B. Jain (Proprietor), Mrs. Ramilaben Dineshbhai Patel (Guarantor Cum Mortgagor), and Mrs. Minaben Mahendrakumar Shah (Guarantor Cum Mortgagor) to repay the amount mentioned in the notice being Rs.24,86,342/- (Rupees Twenty Four Lakh Eighty Six Thousand Three Hundred Forty Two only) as on 31/08/2020 and future interest & expenses thereon.

The Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrowers and the guarantors and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on 07 th day of May, 2023.

The borrowers/guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Indian Bank, Surat for an amount Rs.24,86,342/- (Rupees Twenty Four Lakh Eighty Six Thousand Three Hundred Forty Two only) as on 31/08/2020 and future interest & expenses thereon.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES
(1) All that piece and parcels of the Immovable Property Bearing Situated At Flat No. A-406 On Forth Floor of A Block Of "Raj Residcy", Fulpada, Surat Admeasuring About 641 Sq. Ft. i.e. 59.572 Sq. Mtrs. Developed on land bearing Revenue Survey No. 156/1 Paiky and City Survey Nondh No. 1794 Of Village: Fulpada, Tal: Surat City, Dist: Surat. Boundaries : North: Open Margin, South : Adjoining Lift & Stair, East: Open Margin, West :main Entrance/passage.
(2) All that piece and parcels of the Immovable Property Bearing Situated At Flat No. A-1 On Ground Floor of A Block of "Haridwar Complex", Fulpada, Surat Admeasuring About 535.75 Sq. Ft. i.e. 49.837 Sq. Mtrs. Developed On the land bearing Revenue Survey No. 50 & 51 Paiky, City Survey No. 9382 Of Village: Fulpada, Tal: Surat City, Dist: Surat. Boundaries : North: Backside Structure, South: Main Entrance, East : Adjoining Structure, West : Building Entrance.

Date: 07/05/2023 Chief Manager & Authorised Officer, Place: Surat Indian Bank, Nana Varachha Branch, Surat

The key standalone financial information of the Company is as under:

Particulars	Three Months Ended			Year Ended	
	31.03.2023 (Audited)	31.12.2022 (Unaudited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)
Revenue from operations	1620.40	1360.38	1248.50	5774.17	4803.85
Profit before tax	(86.64)	(3.66)	(84.38)	(222.74)	(394.24)
Profit after tax	(64.86)	(2.74)	(63.14)	(166.71)	(295.02)

The above are an extract of the detailed Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results (Consolidated/Standalone) are available on the website i.e. www.sepower.in and on the Stock Exchanges' websites i.e. www.bseindia.com and www.nseindia.com.

Date : 08.05.2023 For and on behalf of Board of Directors Sd/- (SACHIN AGARWAL) Managing Director

IDFC FIRST Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited)
CIN : L65110TN2014PLC097792
Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai - 600031.
Tel: +91 44 4564 4000 | Fax : +91 44 4564 4022

APPENDIX IV [Rule 8(1)] POSSESSION NOTICE (For immovable property)

Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile IDFC Bank Limited And Presently Known As IDFC First Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with [rule 3] of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notices calling upon the Borrower/ Co-borrowers and Guarantors to repay the amount mentioned in the demand notice appended below within 60 days from the date of receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

The Borrower/ Co-Borrowers/ Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrowers/ Guarantors and public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this notice.

Loan Account Number & Co-borrowers & Guarantors Name	Borrower/s / Co-borrowers & Guarantors Name	Description of the Mortgaged Properties	Demand Notice		Date and Type of Possession Taken
			Date	Outstanding Amount (Rs.)	
1005342972 & 32969906	1. Giradhari Odhavibhai Savaliya, 2. Keertibhai Odhavji Bhai Savaliya, 3. Kasturben Giridharbhai Savaliya	All That Piece And Parcel Of Land Admeasuring About 201.82 Sq. Mtrs., Of Sub Plot No. 56/C, Of "Shree Sainagar Chs Ltd." Lying And Situated At Street No. 07, Revenue Survey No. 66 Of Nanamava Which Is More Identifiy As F.P. No. 81 And 82 Of O. P. No. 24 Of T. P. S. No. 3 (Nanamava), Village Nanamava, B/H, Amamath Mandir, Kalawad Road, Rajkot City, And Bounded As : East : Sub Plot No. 56/A & 56/B, West : 9.14 Mts. Wide Road, North : Plot No. 46, South : Common Plot	19-11-2022	Rs. 1,11,62,539.87/-	05-05-2023 Symbolic Possession
10044970756 & 10046252463	1. Dhamesh Ganatara, 2. Chandresh Bharatbhai Ganatara, 3. Hinaben Dhamesh Ganatara	All That Piece And Parcel Of Property At On Second Floor Admesur-ing Super Built Up Area Of 102 Sq. Mtrs. I.E. 1102 Sq. Mtrs.Ft. In An-gel Apartment , Jaagnath Plot Land Bearing City Survey No. 1418, City Survey Ward No 15/1, Street No. 22 Rajkot, And Bounded As : East : New Jagath Plot Street No. 22 West : Passage, North: Road, South : Road	21-12-2022	Rs. 49,39,945.00/-	05-05-2023 Symbolic Possession
10063943313 & 10063944055	1. Bijal Tejas Soni, 2. Tejas Shirishbhai Soni	All That Piece And Parcel Of Residential Property Of Land Admesur-ing 43.70 Sq. Mtr. Of Sub Plot No. 22 With Building Thereon Of City Survey No. 596, 597, 598 Of City Survey Ward No. 10, Kevdawadi Street No 15, Of Rajkot Ta. Dist.-Rajkot, State-Gujarat, And Bounded As : East : Other's Property, West : House Of Sub Plot No. 2, North : Other's Property, South: Road	22-12-2022	Rs. 35,70,248.00/-	05-05-2023 Symbolic Possession

The Borrower/ Co-borrowers/ Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IDFC First Bank Limited (erstwhile IDFC Bank Limited And Presently Known As IDFC First Bank Limited) for an amount mentioned in the demand notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

Date : 05-05-2023 Authorised Officer IDFC First Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) Place : Rajkot.

Bank of Baroda Bhagatalav (Main) BRANCH : PB. No. 286, Kanpith,Bhagatalav, Surat - 395003 (Guj.) India. Ph. 0261-2431745 Email : bhagat@bankofbaroda.com

Possession Notice (for Immovable property)

Whereas, The undersigned being the authorized officer of the BANK OF BARODA under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice as mention below calling upon the borrowers to repay the amount mentioned in the notice being as mention below. within 60 days from the date of receipt of the said notice.

The borrower cum mortgagor/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower cum mortgagor/Guarantor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 as on below mentioned date.

The borrower/cum mortgagor/Guarantor attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower cum mortgagor/Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, Bhagatalav Branch, Surat for an amount as mention below with interest and Other Charges.

Sr. No.	Name of the Branch	Name of the Account	Name of the borrower
---------	--------------------	---------------------	----------------------

કોટન-ખાંડીના વાયદામાં રૂ. 350ની નરમાઈ : મેન્થા તેલ પણ ટીલું : નેચરલ ગેસમાં સુધારાનો સંચાર

સોના અને ચાંદીમાં વૃદ્ધિ ફૂડ તેલમાં રૂ. 1૫૮ની તેજી



મુંબઈ, તા. ૮
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્સ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપન અને ઈન્વેસ્ટ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં ૨,૫૧,૭૬૬ સોદાઓમાં કુલ રૂ. ૧૮,૨૩૩.૫૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. ૩૫,૩૮૫.૨૬ કરોડનો અને ઓપન-સનો હિસ્સો રૂ. ૧૩૮૩૮.૨૫ કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર ૪૪,૦૮૩ સોદાઓમાં રૂ. ૩,૧૭૩.૮૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૭૮૩ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૬૦,૭૮૩ના ભાવે પહોંચ્યો હતો. પ્રથમ સત્ર સુધીમાં રૂ. ૩૩૩.૫૧ વધી રૂ. ૬૦,૭૮૩ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિનીને કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ. ૧૪૪ વધી રૂ. ૪૮,૭૭૩ અને ગોલ્ડ-પેટલને કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ. ૧૮ વધી રૂ. ૬,૧૨૩ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨,૭૩૩ વધી રૂ. ૬૦,૮૨૧ના ભાવે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં ૧ કિલોદીઠ રૂ. ૭૭,૨૪૮ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૭૭,૩૭૮ અને નીચામાં રૂ. ૭૭,૦૫૫ ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. ૧૧૧ વધી રૂ. ૭૭,૧૫૮ના ભાવે પહોંચ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. ૧૩૦ વધી રૂ. ૭૬,૯૭૩ અને ચાંદી-માઈકો જૂન કોન્ટ્રેક્ટ રૂ. ૧૪૫ વધી રૂ. ૭૬,૯૮૬ના ભાવે પહોંચ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ. ૧,૧૩૮ સોદાઓમાં રૂ. ૮૩૧.૪૧ કરોડના વેપાર થયા હતા. તાંબુ મે

વાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૬,૦૦૮ અને નીચામાં રૂ. ૫,૮૫૦ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. ૧૫૮ વધી રૂ. ૫,૮૫૮ના ભાવે પહોંચ્યો હતો. જ્યારે ફૂડ તેલ-મિની મે વાયદો રૂ. ૧૫૬ વધી રૂ. ૫,૯૮૮ના ભાવે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો ૧ એમએમબીટીયુદીઠ રૂ. ૧૭૮ના ભાવે ખૂલી, રૂ. ૩.૬૦ વધી રૂ. ૧૭૮ના ભાવે પહોંચ્યો હતો. પ્રથમ સત્ર સુધીમાં રૂ. ૩૫,૩૮૫.૨૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૭૮૩ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૬૦,૭૮૩ના ભાવે પહોંચ્યો હતો. પ્રથમ સત્ર સુધીમાં રૂ. ૩૩૩.૫૧ વધી રૂ. ૬૦,૭૮૩ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિનીને કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ. ૧૪૪ વધી રૂ. ૪૮,૭૭૩ અને ગોલ્ડ-પેટલને કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ. ૧૮ વધી રૂ. ૬,૧૨૩ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨,૭૩૩ વધી રૂ. ૬૦,૮૨૧ના ભાવે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં ૧ કિલોદીઠ રૂ. ૭૭,૨૪૮ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૭૭,૩૭૮ અને નીચામાં રૂ. ૭૭,૦૫૫ ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. ૧૧૧ વધી રૂ. ૭૭,૧૫૮ના ભાવે પહોંચ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. ૧૩૦ વધી રૂ. ૭૬,૯૭૩ અને ચાંદી-માઈકો જૂન કોન્ટ્રેક્ટ રૂ. ૧૪૫ વધી રૂ. ૭૬,૯૮૬ના ભાવે પહોંચ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ. ૧,૧૩૮ સોદાઓમાં રૂ. ૮૩૧.૪૧ કરોડના વેપાર થયા હતા. તાંબુ મે

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. ૩૫,૩૮૫ કરોડ અને ઓપનસમાં રૂ. ૧૩૮૩૬.૧૧ કરોડનું ટર્નઓવર બુલડેક્સ વાયદામાં રૂ. ૧૨ કરોડના કામકાજ

સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ. ૦.૩૫ વધી રૂ. ૧૮૪.૨૦ જસત-મિની મે વાયદો રૂ. ૦.૮૫ વધી રૂ. ૨૩૮.૨૦ બોલાઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ૩૮,૮૭૬ સોદાઓમાં રૂ. ૧,૩૭૩.૭૬ કરોડનો વધો થયો હતો. ફૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં ૧ બેરલદીઠ રૂ. ૫.૮૮૨ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૬૩૩.૦૦ અને નીચામાં રૂ. ૬૨૮.૪૦ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. ૩૬૦


૩.૬૦ વધી ૧૮૦.૨ બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ. ૬.૨૦ કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં ૧ ખાંડીદીઠ રૂ. ૬૨.૮૪૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૬૩૩.૦૦ અને નીચામાં રૂ. ૬૨૮.૪૦ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. ૩૬૦

અમેરિકામાં હજુ પણ બીજી ઘણી બેન્કોનું પતન થઈ શકે



વોશિંગ્ટન, તા. ૮
અમેરિકામાં માત્ર બે મહિનાના ગાળામાં ત્રણ મોટી બેન્કોનું પતન થયું તેનાથી દુનિયા ચોકી ગઈ છે. પરંતુ તેલ્યુએશન ગુરુ અથવા દામોદરન માને છે કે આ તો હજુ શરૂઆત છે. અમેરિકામાં બીજી ઘણી બેન્કોનું આવી રીતે પતન થાય તેવી શક્યતા છે. યુએસ બેંકિંગ ઉદ્યોગમાં કટોકટી બહુ મોટી છે અને સ્થિતિ દેખાય છે તેના કરતા વધારે ગંભીર છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર દામોદરને કહ્યું કે અમેરિકન બેંકિંગ સિસ્ટમમાં હજુ બીજી બેન્કો પણ ઘસ્ટ થઈ શકે છે. તેમાં પણ બેન્કો તાજેતરમાં કેટલાક વર્ષોમાં સૌથી વધારે ઝડપથી વધી છે તે બેન્કો પર વધારે જોખમ છે. તેઓ કહે છે કે ૨૦૦૮ કરતા સ્થિતિ અલગ છે. ૨૦૦૮માં મે બેન્કોનું જોખમ લેવાનું વલણ સ્પષ્ટ જોઈ શકતું હતું. તેના કારણે બેન્કો ફેલિટ ગઈ હતી. પરંતુ આ વખતે બેન્કો હાઈ ગ્રોથ માટે આંધળી બની છે અને નિયમો નેવે મુકી રહી છે, જેના કારણે પતન નિશ્ચિત જણાય છે. અમેરિકામાં બે મહિના અગાઉ સિલિકોન વેલી બેન્ક (જીકમ)નું પતન થયું ત્યારથી મુક્ટેલીની શરૂઆત થઈ છે. તેના કારણે અમેરિકન ઈકોનોમી માટે મોટું જોખમ પેદા થયું છે જે બીજા દેશોની નાણાકીય સિસ્ટમ સુધી ફેલાય તેવી શક્યતા છે. અમેરિકામાં બેંકિંગ કટોકટી ખતમ થવાના બદલે આગળ વધી રહી હોય તેમ લાગે છે. થોડા દિવસો અગાઉ ફરફ્ટ રિપબ્લિકન બેન્કનું પતન થયું અને તેને જેપી મોર્ગન દ્વારા ખરીદવામાં આવી હતી. પ્રોફેસર દામોદરને પોતાના લેટેસ્ટ બ્લોગમાં જણાવ્યું છે કે યુએસ બેંકિંગ સિસ્ટમમાં વધુ ઈમિનોનું પતન થશે. બેન્કોનો નફો નહીં પણ તેનું કોન્સિડેરેશન વધશે.

વિશ્વ બેંકના અહેવાલમાં ઘટસ્ફોટ બ્રાઝિલમાં ૨૦૩૦ સુધીમાં લાખો લોકો જળવાયુ પરિવર્તનને કારણે અત્યંત ગરીબ બની જશે



બ્રાઝિલ, તા. ૮
વિશ્વ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આખોડવા સંબંધિત વધુ ૨૦૩૦ સુધીમાં લાખો લોકો જળવાયુ પરિવર્તનને અત્યંત ગરીબીમાં ધકેલી શકે છે. આ રિપોર્ટમાં બ્રાઝિલને રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો માટે રોકાણને વેગ આપવા અપીલ કરવામાં આવી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ અમેરિકાનું આ સૌથી ગરીબ રાષ્ટ્ર કુદરતી આફતો-ખાસ કરીને પૂર અને દુષ્કાળ, ખાદ્યપદાર્થોની વધતી કિંમતો અને ઓછી શ્રમ ઉત્પાદકતા જેવી બાબતોથી પ્રભાવિત થશે. અહેવાલ જણાવે છે કે બ્રાઝિલ પુનઃપ્રાપ્ત ઊર્જાના સ્ત્રોત તરીકે મજબૂત સ્થાન ધરાવે છે, કારણ કે તેનો લગભગ અડધો ઊર્જા પુરવઠો, જેમાં ૮૦% થી વધુ વીજળીનો સમાવેશ થાય છે, પરંતુ તેની જ નવીનીકરણીય ઉર્જામાંથી આવે છે. બ્રાઝિલ માટે વિશ્વ બેંકના કન્ટ્રી રિસ્કરેટ જોહાન્સન ઝટ કહે છે કે તેની ઓછી કાર્બન ક્ષમતાનો સંપૂર્ણ લાભ લેવા માટે બ્રાઝિલે હવેથી ૨૦૫૦ વચ્ચે દર વર્ષે તેના વાર્ષિક જીડીપીના ૦.૫% સોમ્પું રોકાણ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે આ દાયકાના અંત સુધીમાં, આખોડવાની વધુ ૮ થી ૧૦ મિલિયન બ્રાઝિલિયનોને અત્યંત ગરીબીમાં ધકેલી દેશે. ગયા નવેમ્બરમાં વિશ્વ બેંકે તેના અહેવાલમાં કહ્યું હતું કે જળવાયુ પરિવર્તન ધાંધા ગાળાના વિકાસ,

નવા રસ્તાની માંગ સાથે ઓરી ગ્રામજનોનું આંદોલન

રાજપીપળા : નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકો રસ્તા બાબતે રોષે ભરાયા છે. ગામમાં અને સીમમાં જવાનો રસ્તા પરથી મોટી સંખ્યામાં હાઈવાય ટ્રુકો અવર જવર કરતી હોવાથી આખો રસ્તો ખોદાઈ ગયો છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોને આકોશ સાથે જણાવ્યું હતું કે અમને અવરજવર માટે ખુબ મુશ્કેલી પડી રહી છે. ઓરી ગામનો રસ્તો મંજૂર થઈ ગયો છે પરંતુ બનતો નથી એ બાબતે પણ ગ્રામજનો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે બીજા બાજુ રેતીની હાઈવાય ટ્રુકો પણ મોટી સંખ્યામાં અવર જવર કરતા હોવાથી રસ્તો ખોદાઈ રહ્યો છે. જો તંત્ર ઓરી ગામનો રોડ નહિ બનાવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરીશુ એવી ચીમકી ઉચ્ચારી છે.

જ્યારે બેંકમાંથી લોન લેનાર વ્યક્તિઓ લોન ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેવા દેવાદારોને બેંક ડિફોલ્ટર તરીકે જાહેર કરે છે. બેંક દ્વારા **RBI**ની જોગવાઈ પ્રમાણે તે વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે. પરંતુ નાણાં પરત ચૂકવવામાં અસમર્થ વ્યક્તિને રજૂઆત કરવાની તક અપાતી નથી. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિરુદ્ધ રાજેશ અગ્રવાલના કેસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિફોલ્ટરની ગાઈડલાઈનને ચેલેન્જ કરવામાં આવી હતી. બનાવ પક્ષ તરફથી રજૂઆત કરાઈ હતી કે, કોઈ વ્યક્તિને ડિફોલ્ટર તરીકે જાહેર કરવો અને તેને રજૂઆતની એક તક પણ ન આપવી તે રૂલ ઓફ નેચરલ જસ્ટિસની વિરુદ્ધ છે. વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરવાથી તેને અન્ય લોન મળતી નથી. કંપનીના પ્રમોટરને પણ તેને અસર પડતી હોય છે.

લોન ભરપાઈ ન કરી શકનાર દેવાદારને બેંકોએ સાંભળવા પડશે

મુંબઈ, તા. ૮
જ્યારે બેંકમાંથી લોન લેનાર વ્યક્તિઓ લોન ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેવા દેવાદારોને બેંક ડિફોલ્ટર તરીકે જાહેર કરે છે. બેંક દ્વારા **RBI**ની જોગવાઈ પ્રમાણે તે વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે. પરંતુ નાણાં પરત ચૂકવવામાં અસમર્થ વ્યક્તિને રજૂઆત કરવાની તક અપાતી નથી. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિરુદ્ધ રાજેશ અગ્રવાલના કેસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિફોલ્ટરની ગાઈડલાઈનને ચેલેન્જ કરવામાં આવી હતી. બનાવ પક્ષ તરફથી રજૂઆત કરાઈ હતી કે, કોઈ વ્યક્તિને ડિફોલ્ટર તરીકે જાહેર કરવો અને તેને રજૂઆતની એક તક પણ ન આપવી તે રૂલ ઓફ નેચરલ જસ્ટિસની વિરુદ્ધ છે. વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરવાથી તેને અન્ય લોન મળતી નથી. કંપનીના પ્રમોટરને પણ તેને અસર પડતી હોય છે.

આખોડવા પરિવર્તન, વનનાબૂદી અને ઘાસના વિસ્તારોના વિસ્તરણને કારણે ૨૦૫૦ સુધીમાં બ્રાઝિલના જીડીપી પર ઈ ૧.૮, ૪૦૦ મિલિયનની સંચિત અસર થવાનો અંદાજ છે, જે દેશના વર્તમાન જીડીપીના ૯.૭% ની સમકક્ષ છે.

સિંધિવાડમાં સાળાએ બનેલીને ચપ્પુનાં ૬ ઘા મારી જીવલેણ ડુમ્બકો કર્યો

રાજપીપળા, તા. ૮
રાજપીપળા શહેરનાં સિંધિવાડ વિસ્તારમાં રહેતા એક ઈસમ પર તેનાજ સાળાએ નજવી બાબતે ચપ્પુનાં ઘા મારી જીવલેણ ડુમ્બકો કરવાની ઘટના બનતા લોકોટળોએ એકઠા થયાં હતાં. ત્યારબાદ ઈજાગ્રસ્તને રાજપીપળા સિવિલમાં લઈ જવાયું હતો. રાજપીપળા સિંધિવાડ વિસ્તારમાં રહેતા સમીરખાન નાશિરખાન બલુચ (૩૨) ને તેમના પત્ની સાઈમાંબાનું સાથે લગ્નમાં વડોદરા જવા બાબતે નજવી બોલાવાયી થઈ હતી.

જાપાનના મિયાઝાકીની કેરી વિશ્વમાં સૌથી મોઘી : રૂ. ૨.૭૦ લાખની કિલો



નવી દિલ્હી, તા. ૮
કેરીને ફળોનો રાજા કહેવાય છે. ઉનાળા સાથે દેશમાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. વિશ્વમાં ભારતને કેરીની વિવિધ જાતો માટે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં ઉત્પાદિત થતી કેરીની વિશ્વના અનેક દેશોમાં નિકાસ પણ થાય છે. ભારત દેશીથી લઈને લંગડા અને આલ્ફોન્સોથી લઈને બંબેયા સુધીની મીઠાસા વિશ્વભરમાં ફેલાવે છે. જોકે, હવે કેરીની નવી વેરાયટી માર્કેટમાં આવી ગઈ છે, જેને વિશ્વની સૌથી મોઘી કેરી કહેવામાં આવી રહી છે. આમ તો, દેશમાં મોઘવારી વધી રહી છે, એટલે ભારતના ૯૯.૯૯ ટકા લોકો પાસે આ ફળ ખરીદવાની ક્ષમતા નથી તેમ કહી શકાય. આ કેરી વિશ્વની સૌથી મોઘી કેરી છે કારણ કે, ધનવાન લોકોના પરિવારો પણ આખી સિઝનમાં આ કેરીઓ ખાઈ શકતા નથી. આ કેરી હટકે અને મોઘી છે. કેરીની કિંમત તેને વિશ્વના ખૂબ જ અતિ ધનવાન લોકોનું ફળ બનાવી દીધું છે. આ કેરી આપણા

ભારત વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ, આ હવે કેરીની નવી વેરાયટી માર્કેટમાં આવી ગઈ જેને વિશ્વની સૌથી મોઘી કેરી કહેવામાં આવી રહી છે

દેશમાં ઉગાડવામાં આવતી કેરીની ખાસ જાત જેવી જ છે. સિંદુરિયા સિઝનના મધ્યમાં અહીં સામાન્ય માર્કેટમાં આવી જાય છે. આ કેરી ખૂબ જ સુંદર દેખાવ ધરાવે છે, આ કેરી પોતાના સ્વાદ માટે નહીં પરંતુ કિંમતના કારણે જાણીતી છે. જે સ્વાદની વાત કરીએ તો, દેશમાં લંગડા, દેશી અને આલ્ફોન્સો પ્રખ્યાત છે. પરંતુ, આજે આપણે જે વેરાયટી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની કિંમત ૨.૭૦ લાખ રૂપિયા પ્રતિ કિલો છે. તેનું ઉત્પાદન જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે. આ કેરીને મિયાઝાકી કહેવામાં આવે છે. સામાન્ય રીતે કેરીના ઉત્પાદનની બાબતમાં આપણો દેશ માટે જુનું નામ જલીલખાન હવે બદલીને નવું નામ પઠાઈ જલીલખાન રાખે છે. 101, શ્યામ રેસોઈન્સી, ન્યુ સમા રોડ, વડોદરા.

જાહેર મિલિટા

તાલુકા પંચાયત કચેરી, ફતેપુરા ધ્વારા દાહોદ જિલ્લાના પ્રાયોજના વિસ્તારમાં આદિજાતિ બેરોજગાર યુવક યુવતીઓને ટુંડાગાળાની તાલીમ મેળવી તેઓને વ્યવસાયમાં ઉચ્ચ ગુણવત્તાવાળી તાલીમ મેળવી ટુંડાગાળાની કામગીરીમાં જાનમાં વધારો થાય તે માટે નીચે મુજબના ટુંડાગાળાના તાલીમ વર્ગો શરૂ કરવાના થાય છે.

જાહેર મૂલ્યા

જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે મારા ક્લાયન્ટ મેસર્સ પ્રોટેક્સ્ટ ઈન્વેસ્ટ પ્રાઇવેટ લિમિટેડની શાખા ઓફિસ નંબર ૨-૩૦૧, આઈટીસી બિલ્ડિંગ મજુરા ગેટ સુરત (વિરાજકાની) ખાતે નવી શાખા બંધાવી **નીચકુમાર ભારતી દિનેશપ્રસાદ મહંત, શૈલેષ દિનેશપ્રસાદ હુસાવણ અને મલતી સતીશ કુમાર શુભદેવ** અને અન્ય (ઉપર લેનારાઓ)ને વિશ્વ સુવિધા આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે નિચકુમાર ભારતી દિનેશપ્રસાદ મહંત, શૈલેષ દિનેશપ્રસાદ હુસાવણ અને મલતી સતીશ કુમાર શુભદેવ (નીચે મુજબનાઓ) દ્વારા નીચે સુધાર્યા વગર વિલક્ષ્મ ખરીદવા માટે મેસર્સ વિરાટ એન્ટરપ્રાઇઝ એન્ડ બ્રાઉટરી પેરી (વિકેટ) પાસેથી અને ઉપર લેનારાઓ માટે મેસર્સ ક્રાયલેબ ના સુરક્ષિત કરવા માટે ઉત્તર મિલકત પર ગોળી બનાવવા. વિકેટ, ખરીદવા અને લેનારને ખરીદવા અને વિરાજકાની પુલિટ, જાહેર અને ખાનગી આખી છે કે આ મિલકત કોઈપણ ગોળી, લીઝ, લોન, જામીન, નુકશાન, ઉત્પાદકાર, અરજણ, સંપાદન, માંગણી અથવા અન્ય કોઈપણ રીતે આપી નહીં, અને તમામ બાંહેધી મુક્ત અને સ્વચ્છ અને માર્કેટિંગ શીપ્સ અને ગોળી રાખવાનો અને ઉત્તર મિલકત સાથે વ્યવહાર કરવાનો વિશિષ્ટ અધિકાર ધરાવવાનો. નીચે કોઈપણ વ્યક્તિ (અલિયન)ને વેચાણ, ભેદ, લીઝ, વારસો, વિનિમય, મોર્ટેજ, ચાર્જ, પુન્યાધિકાર, ટ્રસ્ટ, વ્યાજબી ધન, કમ્પ્રે, સરખાના, ભાડુ, ધેરા-ભૂમિના, હાઈડ્રા-પાવર, હાઈપ્રોપેક્શન, જાગીર, વારસો, પાવર ઓફ એટર્ની, ઓફર, હુકમનું પુસ્તક, જોડાણ અથવા અન્ય કોઈપણ રીતે દારા તેના કોઈપણ ભાગની ઉત્તર મિલકતમાં કોઈપણ ટંક, શીપ્સ, રસ અથવા ધાવો લીઝ, નો આની તારીખથી ૧૪ દિવસની અંદર નીચે સહી કરવાને સહાયક દસ્તાવેજ સાથે લેખિતમાં જાણ કરવી જરૂરી છે, જેમાં નિષ્ફળ ચવાવી મારા ક્લાયન્ટ આવા દાવાના સંદર્ભ વિના લોનનું વિતરણ કરવા આગળ વધશે અને તે જ, જો કોઈ હોય તો, તેને માફ કરવામાં આવે અને અથવા લખ્યું કે વાંચ્યું તરીકે જાણવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા

આથી વડોદરા મહાનગરપાલિકા હવે વિસ્તારમાં આવેલી જર્જરીત મિલકતોનાં માલિક/કબજેદારોને જણાવવાનું કે આગામી ચોમાસા દરમિયાન વાવાઝોડા કે અતિભારે વરસાદનાં સમયે જર્જરિત મિલકત તરીકે પડવાથી જાન માલ, જાનહાનીને નુકશાન ન થાય તે માટે જી.પી.એમ.સી. એક્ટ-૧૯૮૯ ની કલમ ૨૬૪ હેઠળ આવી મિલકતોને નામજોગ નોટીસ પાઠવામાં આવેલ છે. જેને તાત્કાલિક સ્વપર્યો મિલકત/ મિલકતનો ભાગ ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં કસુરવાર ઠરશે તો તેનાથી ઉપસ્થિત થનાર પરિણામો જેમ કે જર્જરિત મિલકત તરીકે પડવા કે ધરાશયી થવાના પ્રસંગે આપના કે અન્યનાં કિંમતી માલસામાન કે ધર- વખરીને જો કોઈ નુકશાન થશે કે કોઈ અકસ્માત કે જાનહાની થશે તો તેની અંગત જવાબદારી જે તે મિલકતોનાં માલિક/કબજેદારોની રહેશે. જેની ગંભીર નોંધ લેશે. પી.આર.ઓ. નં. ૧૧૪૬ /૨૦૨૩-૨૪ મ્યુનિસિપલ કમિશનર, વડોદરા

વડોદરા મહાનગરપાલિકા
www.vmc.gov.in
આકારણી શાખા
વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં આવેલ વહીવટી વોર્ડ-૧, ૨, ૩, ૭ અને ૧૩ ના હદ વિસ્તારમાં આવેલી તમામ મિલકતોના રીવીઝન આકારણી સર્વેની કામગીરી બાબત.
વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ વહીવટી વોર્ડ-૧, ૨, ૩, ૭ અને ૧૩ ના હદ વિસ્તારમાં આવેલી મિલકતોના માપમાં વધારા / નવીન બાંધકામ હેતુકેર / વપરાશમાં ફેરફાર વગેરેની માહિતી પ્રાપ્ત કરી રીવીઝન આકારણી સર્વેની કામગીરી તા.૦૬-૦૫-૨૦૨૩ના રોજથી શરૂ કરવામાં આવનાર હોઇ ઉપરોક્ત વિસ્તારમાં આવનાર કમ્પ્યારીઓને સાથ સહકાર આપવા વિનંતી છે.
સદર બાબતે આપને કોઈ રજૂઆત હોય તો કામકાજના દિવસોમાં સંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમિયાન આકારણી શાખા, ખંડેરાવ માર્કેટ ખાતે સંપર્ક કરવા વિનંતી છે.
પી.આર.ઓ. નં. ૧૫૦/૨૦૨૩-૨૪ મ્યુનિસિપલ કમિશનર

Madhya Gujarat Vij Company Ltd.
O&M) Circle Office, 3rd Floor, Nagar Palika Bhavan, NADIAD-387001
Ph. No. (0268) 2562204 / 2562208 Fax No. (0268) 2562229
Tender Notice No: 20/23
Tender are invited vide 1). Tender ID No. 586461 (Date is extended up to 12.05.2023) for Providing China Mosaic, G.I. Sheet at Meter Testing Lab, Kota Stone Flooring, dismantling overhead Water Tank and Miscellaneous Civil Works at Mahemdabad Division Office. 2). Tender ID No. 1683359582 for Loading Unloading & Stacking of materials at Nadiad(R) Division Store Campus. 3). Tender ID No. 1683359509 for Work (ARC) of L/C with providing and fixing of required spare-parts and repairing / overhauling / renovating / additional alteration of 63/100/200 KVA L.T. Dist (200/400 Amp damage & burnt ACB) also New ACB & New ACB boxes fixed of various location under Balasinor-1 Sub Division and any s/dns under the jurisdiction of Nadiad Division office. The details are put up on https://www.nprocure.com (for on line submission, view and download) (for Sr. No. 1) & https://tender.guvnl.com/index.html?comcode=91 (for Sr. No. 2 & 3). Be in touch with website till tender is open.
Superintending Engineer, (O&M), MGVCL, C. O., Nadiad
Date: 08.05.2023

S. E. POWER LIMITED
CIN : L40106GJ2010PLC091880
Regd. Off: Survey No. 54/B, Pratapnagar, Jarod-Savli Road, Samlaya, Vadodara-391520 (Guj.)
Tel.: +91 2667 251566, E-mail: cs@sepower.in, Website: www.sepower.in
EXTRACT OF AUDITED FINANCIAL RESULTS (CONSOLIDATED) FOR THE QUARTER & YEAR ENDED 31ST MARCH, 2023
(₹ in Lacs except EPS)
Three Months Ended Year Ended
Particulars 31.03.2023 31.12.2022 31.03.2022 31.03.2023 31.03.2022
(Audited) (Unaudited) (Audited) (Audited) (Audited)
Revenue from operations 1620.40 1360.33 1248.50 5774.17 4803.85
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items) (87.31) (4.02) (98.38) (224.39) (409.21)
Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items) (87.31) (4.02) (85.25) (224.39) (396.08)
Net Profit for the period after tax (65.45) (3.24) (64.46) (168.52) (296.78)
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) (65.45) (3.24) (64.46) (168.52) (296.78)
Paid up Equity Share Capital (Face value of Rs. 10/- per share